

શિક્ષણ અને સમાજ
કલ્યાણ કેન્દ્રનું
માસિક મુખ પત્ર



વર્ષ : ૧૪

અંક : ૫

જીવન ધ્યેય વિષેનું અંગત નિવેદન

૧. પહેલા કોટુંબીક બાબતોમાં સફળ થવું
૨. આત્મશક્તિમાં શ્રદ્ધા રાખીને કોઈ પણ સંજોગોમાં સિધ્ધાંતો પ્રત્યે પ્રામાણિક રહવું.
૩. બીજા લોકોના સલાહ સચુન હંમેશા લેવા.
૪. આવતી કાલનું આયોજન આજે જ કરવું.
૫. ભુલ થવાનો ડર રાખ્યા વગર કોઈ પણ બાબતના સર્જનાત્મક પ્રતિભાવ આપવો.
૬. સહકાર્યકારની સફળતામાં શક્ય તેટલું વધુ યોગદાન આપવું.
૭. પોતાની જાતને વચન આપવું કે હું એક સ્વયં સંચાલીત માણસ બનીશ અને મારા ધ્યેયને પ્રાપ્ત કરવા મથીશ.
૮. પરિસ્થિતી અને સંજોગો પ્રત્યે હું અસહાયતા નહીં અનુભવું.
૯. હું મારી મર્યાદામાંથી મુક્ત થઈને નવી જીવનશૈલી અપનાવીશ જેથી મારી શક્તિ અને પંસદગીનો વિસ્તાર કરી શકું.
૧૦. ધન દોલત મારા સેવક હશે મારા માલીક નહીં, હું મારી આર્થિક સ્વતંત્રતા જાળવી રાખીશ.

what about you ?

I am committed to combating climate change.

I prefer pedal to fuel.

I don't pollute.

I turn off the TV when not in use.

I save energy.

I say 'No' to plastic bags.

I use cloth bags.

I care for every drop.

I save water.

I value trees.

I plant & take care.

I reduce, reuse & recycle.

I don't waste.

પ્રિય વાચક મિત્રો,

ટપક માટે આપ, સહયોગ રાશિ મોકલી શકો છો. ટપકને મોકલવામાં આવનાર આ રકમ ચેક અથવા ડ્રાફ્ટ થી શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રનાં નામે મોકલવા વિનંતી છે. આપની આસપાસ બનતા બનાવો કે જે બીજા લોકો માટે અનુકરણીય હોય તેની વિગતો ટપકને મોકલી શકો છો તેથી અન્ય લોકો તે વિશે માહિતગાર બનશે.

— ટપક ટીમ

જે ખુશી આપણે પ્રાપ્ત કરીએ છીએ તેનો શ્રમ લાગે છે.

ખેડૂતોની કાર્યશાળા

દરીયાઈ પટી પર ખેતી કરતા ખેડૂતોનું હાલ સૌથી મોટું જોખમ વધતી જતી ખારાશ છે. આ ખારાશ અટકાવે તેવા પગલા, તથા ખારાશ નિયંત્રણ સાથે જમીનમાં કેવા પાક લઈ વધું ઉત્પાદન મેળવી શકાય તેવાં પ્રયત્નોના ભાગ રૂપે કોસ્ટલ સેલીનીટી સેલના માધ્યમ દ્વારા જમીન નવસાધ્ય અને વિવિધ પાક વૃદ્ધિ પ્રયોગો પર ૧ દિવસીય કાર્યશાળા તારીખ: ૨૧/૫/૧૨ના રોજ સુત્રાપાડા તાલુકાના ખેરા તથા વેરાવળ તાલુકાના ડારી ગામે યોજાઈ ગઈ જેમાં જમીન સંરક્ષણ, જમીન નવસાધ્ય, માટી તથા પાણી પૃથ્થકરણના ફાયદા તથા નમુના લેવાની પદ્ધતિ વિષે ખેડૂતોને કૃષિ વિજ્ઞાની શ્રી રમેશ રાઠોડ (કૃષિ વિજ્ઞાન કેન્દ્ર) એ માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત જમીન માવજત વિશે, જમીનની તૈયારી અંગે સમજ આપતા જણાવ્યું કે હાલ જમીનની તૈયારી નો સમયગાળો છે. જેથી હંમેશા જમીનમાં ઊંડી ખેડ કરવી જોઈએ જેથી જમીનમાં ઉથલ પાથલ રહે. જો રોટાવેટર થી ટુકી ખેડ કરીએ તો ઊંડા મુળવાળા પાક જેવા કે કપાસ, એરંડાને પુરતું પોષણ મળતું નથી જેથી ખેડ હંમેશા પાવડીવાળા હળથી કરવાની ભલામણ છે. આ ઉપરાંત ઊંડી ખેડથી પોષક તત્વો ઉપર આવે છે. હવાની જમીનમાં અવર-જવર થાય છે. ઊંડી ખેડથી જીવાત નિયંત્રણ થાય છે. ફુગ

તથા જીવાત વગેરેનો નાશ થાય છે. આ ઉપરાંત પાકની ફેરબદલી કરવાથી ઉત્પાદન વધે છે. જમીનને ૩૦-૩૫ દિવસ તપાવવી જરૂરી છે. જ્યારે હાલ આપણે જમીનને નવરી પડવા દેતા નથી જેથી જીવાત મરતી નથી અને રોગ વધે છે. અને સંકલીત જીવાત નિયંત્રીત કરવું જોઈએ જે માટે સુકારા માટે ટ્રાયકોડ્રામા વાપરવી બીજને પટ આપવો, પછી વાવેતર કરવું.

કૃષિ વિજ્ઞાની શ્રી જીતેન્દ્રસીંહ ચૌહાણ (કૃષિ વિજ્ઞાન કેન્દ્ર) એ માટી અને પાણી ચકાસણીના ફાયદા તથા નમુના લેવાની પદ્ધતિ વિષે માહિતી આપી હતી.

શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રના એગ્રીકલ્ચરીસ્ટ શ્રી અશોક શેલાર તથા સુરેશ ગોહિલે નિદર્શન માટે ખેડૂતો પસંદ કરી તેમની જમીન તથા પાણીની ચકાસણી કરવા આયોજન કરવામાં આવ્યું.

નામ, સરનામું, સર્વેનં, પાછલો કયો પાક હતો અને હવે પછી કયો પાક વાવવો તેની વિગતો સાથે નમુના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં મોકલવા જે આઠ દિવસમાં પૃથકરણ દ્વારા જમીનને કયાં તત્વોની જરૂર છે તે જણાવશે. જેના આધારે પોષક તત્વોની ઉણપોને ધ્યાનમાં કરવાની થતી માવજત વિષે ફરી ખેડૂતોની તાલીમ કરી આ પ્રકારના નિદર્શનો અન્યો માટે પ્રેરણારૂપ બનશે.

પ્રસન્તા વસંતની જેમ દિલની તમામ કળીઓને ખીલેલી રાખે છે.

ભગવાન શું પૂછશે અને શું નહિ પૂછે ?

૧. ભગવાન એ નહીં પૂછે કે આપણે કઈ બ્રાન્ડની કાર વાપરતા હતા, પરંતુ એ જરૂર પૂછશે કે કેટલા જરૂરીયાતવાળા અને અશક્ત લોકોને એમના ઘર સુધી પહોંચવામાં આપણે મદદ કરી હતી !

૨. ભગવાન એ નહીં પૂછે કે આપણું ઘર કેટલા સ્ક્વેરફુટનું ક્ષેત્રફળ ધરાવે છે, પરંતુ એ જરૂર પૂછશે કે સાચા દિલથી એ ઘરમાં આપણે કેટલા લોકોને આવકાર્યા હતા.

૩. ભગવાન એ નહીં પૂછે કે આપણી પાસે કેટલા અને કેવાં કપડા છે, પણ એ જરૂર પૂછશે કે કેટલા લોકોના ઉઘાડા શરીર આપણે ઢાંકી શક્યા.

૪. આપણા સામાજિક દરજ્જા અંગે પૂછપરછ કરવાની એ જરા પણ દરકાર નહીં કરે, હા ! આપણા નૈતિક દરજ્જા અંગે એ બરાબર પૂછશે!

૫. આપણી પાસે કેટલી સંપત્તિ હતી એ અંગે જાણવામાં એને રસ નહીં હોય, પરંતુ આપણે સંપત્તિના કે સંપત્તિ આપણી ગુલામ હતી એ અંગે એ જરૂર પૂછશે.

૬. આપણો પગારનો ગ્રેડ કેટલો ઉંચો હતો એ અંગે ભગવાન કશું જ નહીં પૂછે, પણ એને માટે અને એટલો ગ્રેડ હોવા છતાં આપણે કેટલું નીચે ઉતરવું પડ્યું હતું એ તો જરૂર પૂછશે.

૭. આપણને નોકરીમાં, સમાજમાં, સતામાં કે

અન્ય સંગઠનોમાં કેટલી બઢતી મળી એની સાથે એને કંઈ જ લેવા દેવા નથી, પરંતુ બીજા લોકોને આગળ આવવા દેવામાં આપણે કેટલી મદદ કરી કે શું કર્યું સવિસ્તાર નોંધ માગશે.

૮. આપણે કલાસ વનના કે કલાસ ફોરના કર્મચારી હતા એ અંગે એ કંઈ જ નહિ પૂછે, પરંતુ આપણને સોંપાયેલ જે કંઈ કામ હોય તે આપણે નિષ્ઠાપૂર્વક કર્યું હતું કે નહિ એની એ પાકડી પૂછપરછ કરશે... !

આપણો દેશ પ્રગતિ કેમ નથી કરતો ??

૧૦૦ કરોડની વસ્તી માંથી

૭ કરોડ રીટાયર્ડ થઈ ગયા છે.

૧૪ કરોડ હજું સુધી સ્કુલમાં ભણે છે.

૨ કરોડ હજુ ૫ વરસથી નાના છે.

૧ કરોડ લોકો કોલેજમાં રખડી ખાય છે.

૧ કરોડ લોકો હોસ્પિટલમાં હોય છે.

૧ કરોડ લોકો ભીખારી અને બાવા છે.

૧૦ કરોડ લોકો બેકાર છે.

૩૧ કરોડ સરકારના આળસું કર્મચારી છે.

૧ કરોડ લોકો નાના-મોટા નેતા છે જે આપણા પૈસા ખાધા કરે છે.

૨૧,૮૮,૮૮,૮૮૮ મહિલાઓ ઘરમાં બેસી રહે છે.

બાકી બચ્યા આપણે બે આપ ફેસબુકમાંથી ઉંચા નથી આવતા આપ જ વિચારો હું એકલો ભારત દેશ કેવી રીતે ચલાવું ??

જે સમય ચિંતનમાં જાય છે તે તિજોરીમાં જાય છે.

વાર્ષિક મિલન

કાર્યક્રમનો પ્રારંભ સંસ્થાના પ્રમુખશ્રી હાર્દિક વાગડીયાએ દિપ પ્રાગટ્યથી કર્યો હતો. સમૂહ પ્રાર્થના સૌ સાથીઓએ એકાગ્રતાથી કરી હતી. ઈન્સ્ટ્રક્ટર શ્રી હર્ષિદા ભરડાએ કર્ણપ્રિય અવાજમાં સ્વાગતગીત રજૂ કર્યું હતું. શ્રી સુરેશ ગોહીલના આવકાર વક્તવ્ય અને પુર્વ પ્રોજેક્ટ ઓફીસરશ્રી સુરેન્દ્રનાથ નાયકની કર્મચારીઓ અને સંસ્થા વચ્ચેના સંબંધ વિશેની કવાયત, તે અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા જેને અનુમોદન આપતી એક રમત સહભાગીઓ દ્વારા કરવામાં આવી.



સંસ્થાની વર્ષ ૨૦૧૧-૨૦૧૨ ની વાર્ષિક ગતિવિધિની વિગતો રજૂ થઈ જેમાં સંસ્થાની સંચાલક ટીમ તથા સ્ટાફ ટીમ દ્વારા વર્ષ દરમિયાન હાથ ધરાયેલ પ્રવૃત્તિઓની વિગતો શ્રી ભરત વાળાએ રજૂ કરી હતી.

પ્રવૃત્તિઓનાં રણનિતીક આયોજન પર પેનલ ચર્ચાનો દોર શ્રી પ્રો. તળાવીયા, શ્રી સુરેન્દ્રનાથ નાયક, શ્રી દેવચંદ સાવલીયા, શ્રી વિપુલ શેલડીયા, શ્રી પ્રકાશ ભટ્ટી, શ્રી કનુભાઈ નસીત, કંચન વાગડીયા, દિલશાદ રંગારાએ ચલાવ્યો જેમાં તેઓએ પોતાના વિચારો મુક્યા અને તેના પર પ્રતિભાવો મેળવ્યા હતા તે આધારે નીચે મુજબની બાબતો તેઓએ પ્રતિભાગીઓના ધ્યાન પર મુકી હતી.

પ્રોગ્રામ કે પ્રોજેક્ટના મુખ્ય મુદ્દા પર ફોકસ કરવું, બાહ્ય સંબંધો માટે નિયમિત રીતે અધિકારીઓ

પરસ્પર પ્રીતિ પ્રસરાવે એ જ ધર્મ.

તથા જન સમૂહના પ્રતિનિધિઓને મળવું, ચાલુ સમસ્યા આધારિત સામાજિક કાર્યો કરવા જેમકે સ્ત્રીભૂષણ હત્યા, ભષ્ટાચાર અને વ્યસન, યુવક યુવતીઓ મા-બાપની મંજૂરી વિના ભાગીને લગ્ન કરે છે, કોઠાસુઝ દ્વારા મુશ્કેલીઓનું નિરાકરણકરવું, મૂલ્યાંકન-અસરો અને મુશ્કેલી પર વધુ ધ્યાન, સંગઠિત કાર્ય આયોજન, સેવાઓની પહોંચ, ભૂતપૂર્વ સ્ટાફ દ્વારા સંસ્થાની મદદ, બાહ્ય સંપર્કો મજબૂત કરવા તેમજ સ્વસહાય જૂથોની મદદથી નીચેના સ્તરથી માંડીને રાષ્ટ્રીય સ્તર સુધી કામગીરી હાથ ધરી શકાય તેવી શક્યતાઓ દર્શાવી હતી.



સમાપન સત્રમાં શ્રી ધીરુભાઈ વાગડીયાએ ઉક્ત ચર્ચામાથી સામે આવેલા મુદ્દાઓ બાબતે સંસ્થાની હયાત માળખાકીય સુવિધા, માનવબળ કુશળતા તથા નાણાકીય વ્યવસ્થાને ધ્યાનમાં લઈ કરવાની થતી કામગીરી પર આયોજન થઈ શકે તેમ જણાવ્યું હતું. કામની અસરો કે જે લક્ષિત સમૂહમાં જોવી તે બાબત ચર્ચામાં લાવી શકાઈ નહીં પરંતુ સંસ્થાની ટીમમાં કામ કરી ગયેલા વ્યક્તિઓના થયેલ વિકાસની ચર્ચા થઈ હતી. વર્ષ દરમિયાન મુશ્કેલી આવી હોય તે બાબત પણ રજૂ થઈ ન હતી. સેવાઓની પહોંચ ઓછી હોવાની ચર્ચા થઈ પરંતુ સેવાઓની પહોંચ વધી હોય તેવું કાર્ય અહેવાલ દર્શાવે છે. આયોજન માટે સૂચનો મળ્યાં છે તેના પર ટીમ બેસીને આયોજન કરી શકશે તેમ સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

દરેક કામમાં જોખમ હોય છે પરંતુ કશું નહિ કરવામાં મોટું જોખમ હોય છે.

વિશ્વ અસ્થમાં દિવસ ૩ મે ૨૦૧૨ નિમિત્તિ શ્રી ડો એ. જે. ડાવાલા એ લખેલ પ્રાસંગિક લેખ સાભાર રજુ કરેલ છે.

દમ સાથે જીવતા શીખો

દમ એક શારિરીક સમસ્યા છે. હાલમાં ભારતમાં ચાર કરોડ દમના દર્દીઓ છે. ૩૦ લોકોના સમુહમાં ત્રણ અથવા વધારે વ્યક્તિઓને દમ હોઈ શકે ખાસ કરીને નાના બાળકો, યુવાનો, ગ્રામ્ય વિસ્તારની બહેનોમાં અનહદ રીતે વળી રહ્યું છે. આ રોગમાં રિબાસણનું પ્રમાણ વધારે જોવા મળે છે. જેમ કે રોજીંદા કામ, ઉંઘ અભ્યાસ વ્યવસાય કે સામાજિક વ્યવહારમાં ખલેલ પહોંચે છે. શાળા કે કામકાજના સ્થળો પર ચોથા ભાગના લોકો ગેરહાજર રહે છે.

આ રોગ મટાડી શકાતો નથી, પરંતુ સહેલાઈથી નિયંત્રણમાં રાખી અમિતાભ બચ્ચન, રાજકપુર પરિવાર, ઈન્દીરા ગાંધી તથા ઈયાન બોથમ ને અસ્થમા હોવા છતાં સફળ થઈ શક્યા છે. અસ્થમાનો કોઈ ઈલાજ નથી એવી ખોટી માન્યતા થી તેમજ અવૈજ્ઞાનિક કે જાદુઈ ઈલાજ ના ખોટા પ્રચારથી લોકોને જાગૃત કરવા જોઈએ.

આપણા દેશની ૭૦ ટકા ગ્રામ્ય વિસ્તારની બહેનો આજે પણ રાંધવામાં પરંપરાગત બળતણ તરીકે છાણા, કોલસા અને લાકડાનો ઉપયોગ કરે છે જેમાંથી નીકળતો ઝેરી વાયુ સીધા ફેફસા પર અસર કરે છે અને લોકોમાં દમ જેવા રોગોથી પીડાય છે. આ અંગે ગ્રામ્ય વિસ્તારમાં લોક જાગૃતી કરવી જોઈએ. શહેરી વિસ્તારમાં વધતી જતી ગીચ વસ્તી, વાહનો, ટ્રાફિકજામ, જાહેરમા કચરો બાળવાની પ્રથા, મનખા મેળામાં ફટાકડા ફોડવા તેમજ ધુમપાનના વધતા જતા સેવનને કારણે ઝેરી હવાનું પ્રદુષણ અનહદ રીતે વધી રહ્યું છે જેને યુધ્ધના ધોરણે અટકાવવું જોઈએ આ

રોગ કોઈ પણ ઉમરે થાય છે. દમનું નીદાન બહુજ સરળ છે વારંવાર ઉધરસ થાય ઉથલો માર્યા કરે દવાઓથી ખાસ ફાયદો ન થાય શારિરીક પ્રવૃત્તિ કે શ્રમ કાર્ય પછી શ્વાસ લેવામાં તકલીફ પડે છાતી ભીસાય ઉંઘમાંથી જાગી જવું પડે તેમજ શ્વાસ બહાર કાઢતી વખતે સીસોટી જેવો અવાજ આવે તેવા લોકોને દમ હોવાની શક્યતા રહે છે. દમના નિદાનમાં મસમોટા પરીક્ષણની જરૂર રહેતી નથી ફક્ત પીક ફ્લોમીટર દ્વારા ફેફસાની કાર્યશક્તિ માપી નિદાન થઈ શકે છે.

વિશ્વના બધાજ દેશોમાં દમની સારવારમાં ઈન્હેલેશન થેરાપી વધુ સલામત અને અસરકારક સાબીત થયેલ છે. ઈન્હેલેર્સ/સ્પ્રે દ્વારા દવાઓ સીધી શ્વાસ વાટે ફેફસામાં જાય છે. જેને કારણે દર્દીને તુરંત રાહતનો અનુભવ થાય છે. આ પદ્ધતિ દ્વારા લેવાની દવાઓ ની આડઅસર નહીવત હોય છે. તેમજ તેની આદત પડતી નથી સ્તનપાન કે ગર્ભવસ્થા દરમ્યાન કોઈ સમસ્યા નડતી નથી આ દવા જરૂરીયાત પ્રમાણે લાંબો સમય સુધી લેવાની હોઈ તેની લેવાની પદ્ધતિ નિષ્ણાંત તબીબ પાસે શીખી લેવી જરૂરી છે.

દમ થાય તેવા ઉત્તેજકો(ટ્રીગર્સ)કારકો જેમ કે ધુમ-ધુમાડાવાળી જગ્યા ઠંડી હવા, ધુમ્રપાન ખાધ ચીજો દવાઓ કસરત તીવ્ર લાગણીઓ તેમજ ફેફસાના ચેપથી બચવું જોઈએ. આ માટે નાક પર રૂમાલ (માસ્ક) રાખવો જરૂરી છે, ફુગ્ગા ફુલાવવા, ઓશીકામાં હવા ભરવી કે માઉથ ઓરગન વગાડવાથી ફેફસાની કાર્યશક્તિમાં વધારો થાય છે તેમજ દમને લાંબો સમય સુધી સંપૂર્ણ કાબુમાં રાખી શકાય છે.

જરૂર છે આપના સહુના સાથ સહકારની.....

જે સમય ચિંતામાં જાય છે તે કચરાપેટીમાં જાય છે

ટીમ મિટિંગ

સંસ્થાના માસ દરમિયાનના કામ કાજોના મુલ્યાંકનના ભાગરૂપે દર માસે સ્ટાફ મીટીંગ યોજવામાં આવે છે. આ માસે ૨૬ મે ૧૨ ના રોજ માસીક મીટીંગ યોજવામાં આવી હતી.

કારોબારી સભ્યશ્રી ભરતભાઈ વાળાએ સામાજિક કાર્યકરની ભૂમિકા અને જવાબદારીઓ સમજવા માટે પ્રથમ લાક્ષણિકતાઓ અને કૌશલ્યો વિશે પ્રતિભાગીઓની સહભાગિતાથી ઉદાહરણો સાથે ચર્ચા ચલાવી તેના આધારે સંસ્થામાં હાલમાં કાર્યરત સાથીઓની ભૂમિકા અને જવાબદારીઓ સમજવા પ્રયાસ કર્યો.

દયાબેન જાદવ તથા પ્રતિભાબેન માડુ એ માસીક કામગીરી વિશે ચર્ચા—સમીક્ષા કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે દરેક કર્મચારીએ ૩૦-૩૧ તારીએ રીપોર્ટ રજુ કરવો અને ચાલું માસનું તેમજ આગામી માસનું આયોજન લખવું. શ્રી દિપકભાઈ કાપડીયા (પૂર્વ પ્રોજેક્ટ ઓફીસર) એ મુશ્કેલીઓમાં જરૂરી પરિવર્તન પર ચર્ચા ચલાવી જેમાં મંથલી રીપોર્ટ ફોર્મેટ કે જેમાં કાર્યો, કામના અભિગમો અને આયોજનો મુખ્યત્વે રહ્યા. કાર્યકરોના રસ અને આવડત મુજબ કામગીરીની વહેંચણી કરવી અને જરૂરી સમયે પ્રેરણા અને તાલીમ આપવી. મંથલી રીપોર્ટ ફોર્મેટ બદલવા અંગે ખુબ લાંબી ચર્ચા ચાલી હતી. આ મુદ્દો ખુબજ ચર્ચાસ્પદ રહ્યો અંતે

જુનુ રીપોર્ટ ફોર્મેટ પસંદ થયું.

૧. માનવસંસાધન વ્યવસ્થાપન, ૨. નાણાકીય સંસાધન વ્યવસ્થા, ૩. સેવાઓની પહોંચ, ૪. બાહ્ય સંબંધો, ૫. સંસ્થાકીય શીખ, ૬. રણનિતિક વ્યવસ્થાપન પર ચર્ચા આધારિત સ્વમુલ્યાંકન માટે ત્રણ જુથમાં કાર્યકરો વહેંચાયા અને દરેક જુથે બે બે મુદ્દા પર સઘન ચર્ચા કરી પોતાના મત વ્યક્ત કરતા હતા અને સર્વ સંમતિ સધાય તો ઠીક છે નહીતો બહુમતિથી આવેલા મતને માર્કીંગ કરી ચર્ચાના અંતે તેઓની જાણકારી જે હતી તે પ્રશ્નાવલીમાં ભરી ખ્યાતિ ધ્રુવને સોંપવામાં આવી તેમણે ભરત વાળા તથા હાર્દિક વાગડીયાની મદદથી એનાલીસીસ કરવાની કામગીરી ચાલતી હતી તે દરમિયાન વાર્ષિક અહેવાલ વિશેની ચર્ચામાં કર્મચારીઓના અનુભવો, કામની અસરો તથા મુશ્કેલીઓ જેવા મુદ્દાઓના સમાવેશ કરવાની થાય તે બાબતે બધા સંમત હતા પણ આ બાબતો સ્પષ્ટ રજુ ન થતા માસિક અહેવાલ પરથી વિગતો મેળવી લેવા નક્કી થયું દરમિયાન મુલ્યાંકનનું એનાલીસીસ થઈ આવતા તેના પરિણામો જાણી ટપક માટે પરબત ભોળા, કૌશલ્યવર્ધક તાલીમો માટે ભુરાભાઈ વાઢેર, સંપુર્ણ સ્વસ્થતા અભિયાન માટે તૃપેશ વઘાસીયા, સ્ત્રીહિંસા વિરોધી ઝુંબેશ માટે સાજીત રાઠોડ અને વેધરબેઈઝ ઈન્સ્યોરન્સ માટે મનસુખ વેકરીયાને જવાબદારી સોંપી હતી.

બીજું કાંઈ ન આપી શકો તો કાંઈ નહીં અન્યને અભિનંદન તો જરૂર આપજો જ.

Engage on this month

Meeting of farmers producer organisation at Ahemdavad 9th May 12.
Quarterly reivew on capacity building of Village Health Senitation and Nutriation Commeetee of Visavadar block at Ahemdavad 10th May 12.

Trainning on lows of women violence and human rights for members of Mahila Nyay Samitis fecileted by SKNVAW at Amreli 11-12 May 12.

CSPC partner orgnisation's meet at Ahemdavad 14th May 12.

Team meeting on monthly review at Amreli on 26th May 12.

Annual meet at Amreli on 26th May 12
Training for farmers on various crops grown in coastal areas of Sutrapada (Khera) and Veraval (Dari) Block organise by CSPC undertaken by SSKK and collaboration with KVK, Kodinar (21 May 2012)

Ongoing training - Chitrod (Aribharat), Ghusiya (Aribharat & Beauty parler), Pipalva (Aribharat & Beauty parler), Prasali (Aribharat & Beauty parler), Alidar (Beauty parler, Aribharat) Ghantvad (Beauty parler)

માહિતી અધિકાર હેલ્પલાઈન : ૯૯૨૪૦૮૫૦૦૦

Printed, published and edited by Hardik Dhirajlal Vagadia on behalf of Educational & Social Welfare Centre, Published from Tapak Karyalay, 26-Omnagar-3, Hanumanpara Road, Amreli and printed at Geeta Graphics, F-1 Sahjanand market, Station road, Amreli.

Post Reg. No. L2/41/G-AMR-91/RNP/2012
Valid Upto 31/12/2014

RNI No. GUJGUJ/1999/01521
Date Of Issue 1st of month

Book -Post, Printed Matter



ટપક કાર્યાલય :

શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર,
૨૬,ઓમનગર(૩), હનુમાનપરા રોડ,
ગોકુલ પાર્ક સામે, અમરેલી-૩૬૫ ૬૦૧.

Tel/Fax : 02792-223525

E-mail : tapak@sskkamreli.org website: www.sskkamreli.org

જે ખુશી બીજાને આપીએ તેનો શ્રમ કદીએ લાગતો નથી.